

-: અખબારી યાદી:-

દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો માટે ઘર બેઠા કોરોના વેકસીન લેવાની વ્યવસ્થા કરતી રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ શહેરમાં ૧૦૦% વેક્સીનેશન કામગીરી કરવા નવા અભિગમની શરૂઆત: હેલ્પલાઇન નંબર પર કોલ કરો અને મહાનગરપાલિકા આપના ઘરે આવી કોરોના વેક્સીન આપી જશે

તા. ૨૭/૦૯/૨૦૨૧

રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેક્સીનેશન કામગીરી અંતર્ગત શહેરને ૧૦૦% વેક્સીનેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં નિયત કરેલ કોરોના વેક્સીન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે જે વેક્સીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘરે બેઠા કોરોના વેક્સીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ પર ફોન કરવાથી ઘરે આવીને કોરોના વેક્સીન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકો કે જેઓ દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત કે પથારીવશ છે જેમને કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લેવાનો હોય અથવા પ્રથમ ડોઝ લીધાન ૮૪ દિવસ પછી બીજો ડોઝ લેવાનો થતો હોય અથવા કોવેક્સીન રસીનો

બીજો ડોઝ લેવાનો થતો હોય તેઓએ હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ પર ફોન કરવાનો રહેશે જે માટે નીચેની વિગતોએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

* દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લાભાર્થીઓને આ વ્યવસ્થાનો લાભ મળશે.

* લાભાર્થીએ હેલ્પલાઇન નંબર પર સવારના ૦૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી જ ફોનમાં વેક્સીન લેનારની વિગત નોંધાવવાની રહેશે.

* હેલ્પલાઇન કંટ્રોલ રૂમમાંથી જે-તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓને જે-તે આરોગ્ય કેન્દ્ર દ્વારા વેક્સીનની સેવા લાભાર્થીને ઘરે પુરી પાડવામાં આવશે.

* વેક્સીનના સ્ટોકની ઉપલબ્ધી , વેક્સીન સેસનના સમય , જે-તે આરોગ્ય કેન્દ્રના લાભાર્થીની સંખ્યા વિગેરે બાબતો તથા વેક્સીન ગાઈડલાઇનને અનુસરીને હેલ્પલાઇનમાં મળેલ માહિતી બાદ ૨૪ થી ૪૮ કલાકમાં લાભાર્થીને ઘરે વેક્સીન આપવાની વ્યવસ્થા ગોઠવેલ છે.

* હેલ્પલાઇનમાં લાભાર્થીએ મોબાઇલ નંબર , રહેણાંકનું પૂરું સરનામું , વેક્સીનના પ્રથમ કે બીજા ડોઝની માહિતી અચૂક લખાવવાની રહેશે.

* જ્યારે પણ કોર્પોરેશનની વેક્સીનેશન ટીમ ઘરે રસી આપવા માટે આવે ત્યારે લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ , મોબાઇલ નંબર તથા લીધેલ વેક્સીનની વિગત સ્થળ પર અચૂકપણે રાખવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ અભિગમમાં શહેરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો નિ:શુલ્ક વેક્સીનેશન સેવાનો લાભ લેવા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોર અપીલ કરે છે.

(જન સંપર્ક અધિકારી)
રાજકોટ મહાનગરપાલિકા